

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૩/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૨૫ વ્યક્તિઓને ઝડપી, ૨૨૩ લીટર દેશી દારૂ, ૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૦૦ નાની બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ કાર, ૧ સ્કૂટર અને ૨ મોટર સાયકલ કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૩,૨૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૦૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૬૦૪/૧૮

કાગડાપીઠ : છોગાલાલ બસરાજ મહેતા(રહે,તુલીપ સિતાડેલ માણેકબાગ શ્રેયસ ટેકરા પર આંબાવાડી) એ તા.૨૭/૩/૧૮ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૪/૨૦૧૬ થી તા.૨૪/૦૬/૨૦૧૭ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ભુપેન્દ્રકુમાર ઉર્ફે પિન્ડુ જવાહરલાલ કવાડ (રહે,દુકાન નંબર-૬૩, પહેલો માળ હિરાભાઈ માર્કેટ પારેખ ટાવર પાસે કાંકરીયા રોડ અમદાવાદ) નાએ છોગાલાલને વિશ્વાસમાં લઈ તેમની ન્યુ કલોથ માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નંબર-૫૧ ખાતે આવેલ છગનલાલ છોગાલાલ ટેક્સટાઇલ મિલ્સ નામની પેઢીમાંથી કાપડનો માલ કુલ કિંમત રૂપિયા ૬૧,૭૯,૨૭૮/- મતાનો મેળવી લઈ, તે માલના ચુકવવાના નાણાં પેટે પોતાના તથા ત્રાહિત વ્યક્તિઓના નામના ચેકો આપી, ચેકો રીટર્ન કરાવડાવી પોતાની દુકાન બંધ કરી નાસી જઈ, છોગાલાલ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.વી.ખરાડી ચલાવે છે.

રોકડ ભરેલ થેલી ખેંચી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૬૦૫/૧૮

મેઘાણીનગર : સાવિત્રીબેન વા/ઓ મુન્નાલાલ પ્રજાપતિ (રહે,શ્યામનગર ગલી-૩ ભગવતી સ્કુલ પાસે ભાર્ગવ રોડ મેઘાણીનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૩/૧૮ બપોરનાં ૨/૦૦ વાગ્યાના સુમારે મેઘાણીનગર લીમડા બસ સ્ટેંડ પાસે આવેલ મુતરડી આગળ એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ સાવિત્રીબેનના હાથમાંથી રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- તથા બે પાસબુક મુકેલ થેલી ખેંચી ઝુંટવી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.જી.રાવલજી ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૬૦૬/૧૮

ખાડીયા : કસ્તુરભાઇ મંગળભાઇ શાહ (રહે,વકીલની ખડકી, ઉભો ખાંચો નાગજી ભુદરની પોળ માંડવીની પોળ માણેકચોક) એ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૩/૧૮ સાંજનાં ૬/૩૦ થી તા.૨૭/૦૩/૧૮ ના કલાક ૮/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાનો નફ્ફયો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૦,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.ડી.ચૌધરી ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૬૦૭/૧૮

પાલડી: યુવરાજ મનહરલાલ મકવાણા (રહે,સમુત્કર્ષ એપાર્ટમેન્ટ શ્રેયા ફ્લેટની બાજુમા સુખીપુરા બસ સ્ટોપ પાસે પાલડી) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૩/૧૮ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પોતાની હોન્ડાઈ વર્ના કાર નંબર જીજે.૧૮.બી.સી.૯૯૫૪ કિંમત રૂપિયા ૬,૮૭,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જે કારમાં રોકડ રૂપિયા ૯,૪૦૦/- અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મુકેલ હતો જે કાર કોઇ અજાણી વ્યક્તિ તા.૨૬/૩/૧૮ ના કલાક ૯/૩૦ વાગ્યા દરમ્યાન ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એફ.એ.પારગી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.